

Date: 11th November, 2023

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir / Ma'am,

**Subject: Newspaper Advertisement of extract of Unaudited Financial Results
for the quarter and half year ended on 30th September, 2023**

Ref: Security Id: MUNCAPM/ Code: 511200

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 11th November, 2023 of Unaudited Financial Result for the quarter and half year ended on 30th September, 2023 in:

1. English Newspaper – Financial Express Newspaper and
2. Regional Language Newspaper (Gujarati) – Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You.

For, Munoth Capital Market Limited

Siddharth Jain
Managing Director
DIN: 00370650

MUNOTH CAPITAL MARKET LIMITED

CIN : L99999G1986PLC03614
Address: Shant Nivas, Opp. Shapath - V. M. Karnavati Club, S.G. Road, Ahmedabad - 380056

Extract of Standalone Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30/09/2023

Table with 4 columns: Sr. No., Particulars, Quarter ended on 30.09.2023, and Year to Date Figures. Includes rows for Total Revenue, Net Profit, and Earnings Per Share.

Note: The above is an extract of the detailed format of Quarterly and Half Yearly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

For, Munoth Capital Market Limited
Siddharth Jain
Managing Director
DIN: 00370650

DECO-MICA LIMITED

(Corporate Identity Number : L20299G1988PLC010807)
Regd. Office : 306, 3rd Floor, Iscon Mall, Star Bazar Building, Jodhpur Char Rasta, Ahmedabad - 380 015

STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULT FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2023 (Rs. in Lacs)

Table with 7 columns: Sr. No., Particulars, Quarter ended on 30/09/2023, Quarter ended on 30/09/2022, Half Year ended on 30/09/2023, Half Year ended on 30/09/2022, and For the Year ended on 31/03/2023. Includes rows for Total Income from Operations, Net Profit, and Earnings Per Share.

Notes: (1) The above is an extract of the detailed format of Standalone Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

By Order of the Board of Directors For, DECO-MICA LIMITED
sd/- Mr. Vijaykumar D. Agarwal
Managing Director & CEO - DIN No: 01869337

SBFC Finance Limited

Registered Office:- Unit No. 103, First Floor, C&B Square, Sangam Complex, Village Chakala, Andheri- Kurla Road, Andheri (East), Mumbai-400059.

POSSESSION NOTICE (As per Rule 8(2) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas the undersigned being the Authorized Officer of SBFC Finance Limited under the Securitization, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices upon the Borrowers/Co-borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

Table with 3 columns: Name and Address of Borrowers & Date of Demand Notice, Description of Property(ies) & Date of Possession, and Amount demanded in Possession Notice (Rs.).

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Bank of Baroda

Branch: Shop No. 7-12, GF, "B" Plaza Pushp Business Campus, SP Ring Road, Vastrai, Ahmedabad-382418.

ANNEXURE 3 - POSSESSION NOTICE - FOR IMMOVABLE PROPERTIES

Whereas, the undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 15.04.2023 calling upon the below mentioned Borrowers to repay the below mentioned amount within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken SYMBOLIC POSSESSION of the properties described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 in this 07th day of November of the year 2023.

The Borrowers/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Bank of Baroda for below mentioned amount and interest thereon at the contractual rate plus cost, charges and expenses till date of payment.

The borrower's attention is invited to sub-section (8) of Section 13 in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES
Borrowers : Mrs. Sarojben Anandkumar Prajapati & Mr. Anandkumar M. Prajapati

All that part and parcel of the property consisting of Residential Flat No. E/501, 5th Floor (As per approved plan fourth floor on hollow plinth), Divya Shruti Residency, Nr. Kalpataru Residency, Opp. Adyay Residency, Vastrai, Ahmedabad - 382418. Survey / Block No. 749/2, T.P.S. No. 114 (Vastrai - Ramoji) O.P. No. 10/2, F.P. No. 10/2, Mouje : Vastrai, Ahmedabad.

Borrower : Mr. Rameshbhai Shantibhai Thakor

All that part and parcel of the property consisting of Flat No. M/102 on 1st Floor, Devnandan Supremus, Nr. Galaxy Township, Opp. RAF Camp, SP Ring Road, Vastrai, Ahmedabad-382418 situated on N.A. land bearing Block No. 7 (Revenue Survey No. 773/2) admeasuring about 27,923 sq. mtr. having Town Planning Scheme No. 114, Final Plot No. 30/2 admeasuring about 16750 sq. mtr lying and being at Mouje : Vastrai, RSR No. 773/2, TP 114, FP 30/2, Taluka - Ahmedabad, City, District - Ahmedabad, Sub-District - Ahmedabad - 7 (Odhav).

Date : 07.11.2023 Place : Ahmedabad Chief Manager, Authorised Officer

Union Bank of India, Regional Office Junagadh, MEGA E - AUCTION SALE NOTICE

E Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with provision to 8 (6) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s, that the below described immovable property mortgaged / charged to Union Bank Of India (Secured Creditor), the possession of which has been taken by the Authorized Officers of Union Bank of India, will be sold on "AS IS WHERE IS", "AS IS WHAT IS", and "WHATEVER THERE IS" basis, for recovery of respective dues mentioned hereunder against the secured assets mortgaged/charged to Union Bank of India, from respective borrower(s) and guarantor(s). The detail of terms of sale have been uploaded in the website. The reserve price and earnest money deposit is shown there against each secured asset. The sale will be done by the undersigned through e-auction platform provided here under:

Last date of depositing EMD : On or before the commencement of e-Auction - Date and time of Auction : 29.11.2023 from 12.00 AM to 05.00 PM

Table with 6 columns: Sr. No., Branch Name & Name of the Borrower/ Guarantor & amount Outstanding, Description of the properties, Reserve price (in lakhs), EMD of the property (In Rs.), Bid Increment Amount, and Account details for depositing EMD: A/c No. & IFSC CODE. Contains 15 entries for various properties.

Terms and conditions of the E - Auction as under : 1. Details of Encumbrances over the property as known to the Bank: Not Known. 2. Interested bidder are requested to register their detail with service provider https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp by submission/verification of KYC documents and transfer of EMD in WALLET must be completed well in advance at least two days before auction date.

SALE NOTICE TO BORROWERS / GUARANTORS

This may also be treated as notice under 8(6) of Security Interest (Enforcement) Rules, 2002 to the borrower/s and guarantor/s of the said loan about the holding of E - Auction Sale on the above mentioned date.

ISHAN DYES & CHEMICALS LIMITED

Reg. Off : Plot No. 18, GIDC Estate, Phase I, Vatva, Ahmedabad 382445
Tel. : 079-2583144/25839607, Fax: 079-25833643

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2023

Table with 5 columns: Particulars, Quarter Ended 30-09-23, Quarter Ended 30-09-22, Half Year Ended 30-09-23, and Half Year Ended 30-09-22. Includes rows for Total income from operations, Net Profit, and Earnings Per Share.

Note: The above is an extract of the detailed format of Un-Audited Standalone Financial Results of the Company for the Quarter and Half Year ended 30th September, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.

For and on behalf of the Board of Ishan Dyes & Chemicals Limited
Shrinal P. Patel
Whole Time Director
DIN : 02992519

CHARMS INDUSTRIES LIMITED

(CIN : L72900GJ1992PLC017494)
Regd. Office: 108/B - 109 Sampada Complex, Mithakhali Six Roads, Opp. Harekrishna Complex, Ahmedabad - 380009

EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2023

Table with 5 columns: Sr. No., Particulars, Quarter Ended 30/09/2023, Half Year Ended 30/09/2023, and Year Ended 31/03/2023. Includes rows for Total income from operations, Net Profit, and Earnings Per Share.

Note: 1. The above is an extract of the detailed format of Quarterly/Half Yearly Unaudited Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

For, Charms Industries Limited
Shivkumar Raghunandan Chauhan
Managing Director
DIN : 00841729